

Date: 12/03/2024

To General Manager-Listing Corporate Relationship Department BSE Limited P.J. Towers Dalal Street, Mumbai-400001 BSE Scrip Code: 539594	To Listing Division, Metropolitan Stock Exchange of India Limited 4 th Vibgyor Tower, Opp. Trident Hotel, Bandra-Kurla Complex, Mumbai-400098 MSE Symbol: MISHTANN
--	---

Dear Sir/madam,

Sub: Newspaper Advertisement for fixing record date for rights issue of equity shares of the Company ("Rights Equity Issue")

Pursuant to Regulation 42 of the Securities Exchange Board of India (Listing Obligations and Disclosure Requirements) Regulation, 2015, we are enclosing herewith copies of advertisements issued by the Company on March 12, 2024, in connection with record date for determining the entitlement of the members in the rights equity issue of the Company in (i) Financial Express (English newspaper), (ii) Financial Express (Gujarati newspaper).

You are requested to take the same on record.

Thanking You,
Yours faithfully,

For Mishtann Foods Limited

Shah
Shivangi
Digant

Digitally signed by Shah Shivangi Digant
DN: c=IN, o=Personal, postalCode=380061,
l=Ahmedabad, st=Gujarat, street=114 Ghanshyam,
Ahmedabad City, Ahmedabad City Gujarat India-
380061, Near Ajlun Tower, title=2095,
2.5.4.2b-6b6411886002ca9d0f19aad265337c
4e37a98b3a34b7fdded2291e20a1,
serialNumber=cn=7511a357ebad11b0b22c1af2d4
c0e702b84a664a382a80bb3e7a339,
email=shivangishivangi442@gmail.com, cn=Shah
Shivangi Digant
Date: 2024.03.12 13:10:38 +05'30'

Shivangi Shah
Company Secretary and Compliance Officer
Membership No. A53342

Encl: A/a

GRIHUM HOUSING FINANCE LIMITED
(Formerly known as Poonawalla Housing Finance Ltd.) - Registered Office: 602, 6th Floor, Zero One IT Park, Sr. No.79/1, Ghorpadi, Mundhwa Road, Pune-411036.

POSSESSION NOTICE (For Immovable Property)

Whereas, the undersigned being the Authorized Officer of Grihum Housing Finance Limited (formerly known as Poonawalla Housing Finance Limited as the name Poonawalla Housing Finance Limited changed to Grihum Housing Finance Limited with effect from 17 Nov 2023 (Previously known as Magna Housing Finance Limited and originally incorporated with name of GE Money Housing Finance Public Limited Company) herein after referred as Secured Creditor of the above Corporate/ Register office, under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (hereinafter referred as the "said Act") and in exercise of the powers conferred under Section 13 (12) of the said Act read with Rule 3 of the Security Interest (Enforcement) Rules 2002, issued a demand notice below dated calling upon the below Borrowers to repay the amount mentioned in the notice within 60 days from the date of receipt of the said notice. The borrowers having failed to repay the amount, notice is hereby given to the borrowers and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on him/ her under Section 13 (4) of the said Act read with Rule 8 of the said rules of the Security Interest Enforcement Rules 2002 on this 6th Day of March of the Year 2024.

The borrowers in particular and the public in general are hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of secured Creditor the amount and interest thereon. The borrower's attention is invited to provisions of sub-section (8) of section 13 of the Act, in respect of time available, to redeem the secured assets. Details of Property taken in possession are herein below.

Sr. No.	Name of Borrowers	Description of Property	Possession-taken Date	Date of statutory Demand Notice	Amount in Demand Notice (Rs.)
1.	Solanki Jayeshkumar Solanki Laxmben Jayeshkumar Solanki Ranjanben Marathai,	All That Piece & Parcel of Flat No A-104-1 st Floor, Shreeji Ashraya, Beside Darshanam Orchid, Opp Nehru Chacha Nagar Plot No. 1, Plot No. 3, Pp No. 18, Opp No.80 Adm.49.61 Sq.Mtr. City Of Vadodara. Beside Darshanam Orchid, Gujarat-390019 East By-By Adj Open To Sky And Road 5 Mtr.West By- Adj Ots And Common Passage-Lift-North By-Ots And Flat No B103, South By- Adj Ots.	06/03/2024	07/10/2023	Loan No.HF/0222/H/20100014 Rs.12,68,617.8/- (Rupees Twelve Lakh Sixty Eight Thousand Six Hundred Seventeen Paise Eighty Only) payable as on 07/10/2023 along with interest @ 9.72 p.a. till the realization.

Place: Gujarat
Dated: 12-03-2024

Sd/- Authorised Officer
Grihum Housing Finance Limited, (Formerly known as Poonawalla Housing Finance Limited)

POSSESSION NOTICE

Whereas, the authorized officer of **Jana Small Finance Bank Limited** (Formerly known as Janakashmi Financial Services Limited), under the Securitization And Reconstruction of Financial Assets And Enforcement of Security Interest Act, 2002 and in exercise of powers conferred under section 13 (12) read with rule 3 of the Security Interest (Enforcement) Rules 2002 issued demand notices to the borrower(s) Co-borrowers(s) calling upon the borrowers to repay the amount mentioned against the respective names together with interest thereon at the applicable rates as mentioned in the said notices within 60 days from the receipt of the said notices, along with future interest as applicable incidental expenses, costs, charges etc. incurred till the date of payment and/or realisation.

Sr. No.	Loan No.	Borrower/ Co-Borrower/ Guarantor/ Morgagor	13(2) Notice Date/ Outstanding Due (In Rs.) as on	Date/ Time & Type of Possession
1	31029610000363	1) Suresh Kumar, 2) Vimaladevi Sureshkumar Varna	22/12/2023, Rs.8,72,742.00 (Eight Lakh Seventy Two Thousands Seven Hundred and Forty Two Rupees Only) as of 19/12/2023	Date: 06/03/2024 Time: 02:00 PM Physical Possession
Description of Secured Asset: All that piece & parcel of Immovable Property of Plot No.68 admeasuring admeasuring 40.15 Sq.mtrs., having Ground Floor Constuction admeasuring 40.15 Sq.mtrs., Built up area, alongwith proportionate Undivided Share in Road & COP admeasuring 33.18 Sq.mtrs., "NILKANTH VILLA", developed upon land situated in State Gujarat, District Surat, Sub-District & Taluka Mangrol, Moje Village Kurvadra, bearing Revenue Survey No.348 Paikes, 350/2, 351, Flat No.327/A admeasuring 8100 Sq.mtrs., For Residential Purpose N.A. Land Paikes. Boundaries by: East: Plot No.59, West: Society Road, North: Plot No.69, South: Plot No.67.				
2	30719610000331	1) Ladukishar Swain, 2) Pusanpalji Swain	22/12/2023, Rs.7,33,391.00 (Seven Lakh Thirty Three Thousands Three Hundred and Ninety One Rupees Only) as of 19/12/2023	Date: 06/03/2024 Time: 03:01 PM Physical Possession
Description of Secured Asset: All that piece and parcel of Immovable Property bearing Plot No.38 admeasuring 12'36" FT. i.e. 48.05 Sq.Yard., i.e. 40.18 Sq.mtrs., in the society which is known as "RADHA SWAMI RESIDENCY", along with undivided proportionate share admeasuring 25.30 Sq.mtrs., in Road, Rastia and COP of the said society situated at land bearing Revenue Survey No.28 its Block No.16 admeasuring 10421 Sq.mtrs., of Village Syadia, Sub Dist. Tal. Olpad, Dist. Surat. Boundaries by: East: Adj. Plot No.37, West: Adj. Plot No.39, North: Adj. Society Internal Road, South: Adj. Plot No.28.				
3	31519630000011	1) Bhatia Gaurav, 2) Shankarlal Maganlal Bhatia, 3) Madhuben Shankarabhai Bhatia	18/09/2023, Rs.13,53,331.80 (Thirteen Lac Fifty Three Thousand Three Hundred Thirty One Rupees and Eighty Paise) as of 11/09/2023	Date: 06/03/2024 Time: 12:45 PM Symbolic Possession
Description of Secured Asset: All the piece and parcel of Immovable Property being Mouje Ali, Bharuch, lying being land bearing R.S. No.12, admeasuring 7383.00 Sq.mtrs., Paiki Plot No.20 to 28, 57 & 62, 91 to 129 Paiki Known "BHARTI NAGAR", Paiki Sub Plot No.39, admeasuring 96.27 Sq.mtrs., Consolation admeasuring 59.85 Sq.mtrs., Additional Plot admeasuring 47.16 Sq.mtrs., Total admeasuring 203.28 Sq.mtrs., at Registration District & Sub-District & District Bharuch. Boundaries by: East: Plot No.40, West: Open Space of Plot No.38, North: Survey No. South: Wide Road.				
4	45169420000272	1) Kir Jitendra, 2) Kahar Radhakishan, 3) Rathod Maheshbhai	22/12/2023, Rs.21,85,598.00 (Twenty One Lakhs Eighty Five Thousands Five Hundred and Ninety Eight Rupees Only) as of 19/12/2023	Date: 07/03/2024 Time: 09:09 AM Symbolic Possession
Description of Secured Asset: Property bearing Flat No.701, on Block No.B on 7th Floor, admeasuring about 49.78 Sq.mtrs., Carpet area and 2.26 Sq.mtrs., wash area and 1.61 Sq.mtrs., Balcony and undivided share 21.56 area, in the scheme known as "SHIV KRUPA RESIDENCY", situated at Mouje Vatva, Tal. Vatva, Dist. Ahmedabad on land bearing Final Plot No.256 of T.P. Scheme No.128 of Survey No.1269 in the Registration Sub-District and District of Ahmedabad-11 (Asiali).				
5	30979610000082	1) Amitkumar Singh, 2) Pooja Amitkumar Singh	28/12/2023, Rs.15,46,535.00 (Fifteen Lakhs Forty Six Thousands Five Hundred and Thirty Five Rupees Only) as of 19/12/2023	Date: 07/03/2024 Time: 09:18 AM Symbolic Possession
Description of Secured Asset: All that piece and parcel of Freehold Immovable Property being Flat No.B-2/103 (as per plan B-17103), having carpet area admeasuring 28.20 Sq.mtrs., & Built-up area admeasuring 56.86 Sq.mtrs., alongwith undivided share in land admeasuring 13.84 Sq.mtrs., in the scheme known as "KAILASH TRITH AVENUE", situated at land bearing Freehold Non-Agricultural land bearing Block Survey No.1253+1/1253+2/1256/2 being Final Plot No.243 (243+1/243/2) of Town Planning Scheme No.128 of Mouje Vatva of Taluka Vatva in the District of Ahmedabad and Registration Sub-District of Ahmedabad-11 (Asiali). Boundaries by: East: Flat No.B-1-107, West: Flat No.B-2-102, North: Society Road, South: Flat No.B-2-104.				
6	30979420000013	1) Rajesh Shankarlal Nai, 2) Rina Rajesh Nai	26/12/2023, Rs.14,92,666.00 (Rupees Fourteen Lakhs Ninety Two Thousands Six Hundred and Sixty Six Only) as of 19/12/2023	Date: 07/03/2024 Time: 10:13 AM Symbolic Possession
Description of Secured Asset: All part and parcels of immovable property being Flat No.210, on Block "N" on Second Floor, admeasuring 70 Sq.Yards super built up area and living carpet area 33.71 Sq.mts. and with undivided right in land admeasuring 13 Sq.mtrs. in the Scheme known as "DEVANANDAN SANKALP CITY" constructed on the land of Survey No.75 paiki 1 of admeasuring 47450 Sq.mtrs., Mouje/ Village Hanshpura, More specific situated on the land of F.P. No.114, paiki admeasuring 27979 Sq.mtrs. of TPS No.121 of Mouje/ Village Hanshpura, Taluka Ashrava, Sub Dist. Ahmedabad-6 (Nardoda) and Dist. Ahmedabd. Boundaries: East: Society Road, West: Flat No."N"211, North: Flat No."N"209, South: Society Road.				
7	34269420001412	1) Chorasia Sanjayprasad, 2) Sarita Devi	26/12/2023, Rs.15,62,222.00 (Rupees Fifteen Lakhs Sixty Two Thousands Two Hundred and Twenty Two Only) as of 19/12/2023	Date: 07/03/2024 Time: 10:21 AM Symbolic Possession
Description of Secured Asset: All Parts and parcels of immovable property being Flat No.311, on Block "L" on 3rd Floor, admeasuring 75 Sq.Yards super built up area and admeasuring 34.48 Sq.meters Carpet area, together with undivided rights in land admeasuring 14 Sq.meters, in Scheme known as "DEVANANDAN SANKALP CITY" constructed on the land admeasuring 47450 Sq.mtrs. of Survey No.75 paiki 1 of Survey No.75 paiki 1 of Mouje/ Village Hanshpura, More specific situated on the land of F.P. No.114 paiki admeasuring 27979 Sq.mtrs. of TPS No.121 of Mouje/ Village Hanshpura, Taluka Ashrava, Sub Dist. Ahmedabad-6 (Nardoda) and Dist. Ahmedabad. Boundaries: East: Flat No."L" 310, West: "L"312, North: "L"308, South: Society Road.				
8	30979420000272	1) Vinodbhai Hamirbhai Valodra, 2) Valodara Vijuben Hamirbhai, 3) Kabira Ravindrabhai	26/12/2023, Rs.13,25,038.00 (Rupees Thirteen Lakhs Twenty Five Thousands Thirty Eight Only) as of 19/12/2023	Date: 07/03/2024 Time: 03:30 PM Symbolic Possession
Description of Secured Asset: All that piece and parcel of immovable Property being Flat/ House No.154/1841, (i.e. Flat No.1841 in Block No.154), having area admeasuring 26.38 Sq.mtrs., in "SHIVALAY APPARTMENT", a scheme of F&C LG scheme of Gujarat Housing Board Situated and lying on Leasehold land bearing Survey No.215/2, Final Plot No.368, 369, 370 of T.P. Scheme No.29 of Mouje Wadaj of Taluka Sabarnati in the District of Ahmedabad and Registration Sub-District of Ahmedabad-2 (Wadaj) within the State of Gujarat. Boundaries: East: Flat No.1842, West: Road, North: Flat No.1832, South: Srair & Flat No.1844.				
9	45249420005194	1) Sorathiya VivekKumar Karshanbhai, 2) Sorathiya Pinal VivekKumar	26/12/2023, Rs.16,10,541.00 (Rupees Sixteen Lakhs Ten Thousands Five Hundred and Forty One Only) as of 19/12/2023	Date: 07/03/2024 Time: 03:30 PM Symbolic Possession
Description of Secured Asset: All that piece and parcel of the immovable Property bearing Plot No.13, (After K.J.P. Block No.1471/3 admeasuring 40.26 Sq.mtrs., admeasuring 40.26 Sq.mtrs., along with undivided share admeasuring 21.07 Sq.mtrs., in the Road & C.O.P. Totally admeasuring 61.33 Sq. 33 Sq.mtrs., in "SWSTIK RESIDENCY", Situated on the Non-agriculture land bearing Revenue Survey No.114, Block No.141, admeasuring 12962 Sq.mtrs., Aakar RS. 12.44 Paisa, of Mouje Village Kamrej, Sub-District Kamrej, District Surat. Boundaries by: East: Adj. Open Space, West: Adj. Society Road, North: Adj. Plot No.12, South: Adj. Plot No.14.				
10	31529420003143	1) Makavana Vikram Amubhai, 2) Makwana Chandrikaben	27/02/2023, Rs.8,95,859.00 (Eight Lakh Ninety Five Thousand Eight Hundred Fifty Nine Rupees) as of 23/02/2023	Date: 09/03/2024 Time: 01:00 PM Physical Possession
Description of Secured Asset: Immovable Property of Open N.A. land of Plot No.201 Paiki land admeasuring 55.72 sq.mtrs. (Known as Sub Plot No.201/C) of R.S. No.21 Paiki land admeasuring Ac. 12.39 Guthas of Jetpur-Navagadh Nagarpalka, Ta. Jetpur, Dist. Rajkot. Boundaries: East by: Property of Plot No.200, West by: Property of Plot No.201/B, North by: Property of Plot No.198, South by: 9.14 mtrs. wide Road.				
11	31529420003742	1) Chovatiya Chirag Mansukhbhai, 2) Chovatiya Monika Chirag	08/09/2023, Rs.12,82,582.03 (Twelve Lac Eighty Two Thousand Five Hundred Eighty Two Rupees and Three Paise) as of 04/09/2023	Date: 09/03/2024 Time: 04:30 PM Physical Possession
Description of Secured Asset: All that piece and parcel of Residency Flat admeasuring about 48.97 Sq.mtrs., situated at Final Plot No.11 of R.S. No.13P, Survey No.7826/11/1, Block/ Building No. SHEET No.72, Hse No.102, Floor N/A, Building/ Society Name Shri Hari Vandana Apartment, Street No/ Name Nr. Canal, Area Raiyari Nagar-1, City Jetpur Dist. Rajkot. Boundaries by: East: Canal and Open Land, West: OTS and Block No.103 and Lift, North: D P Road, South: Block No.101.				
12	34269420001194	1) Saumin Dineshkumar Patel, 2) Patel Pratiksha Sauminkumar	10/11/2023, Rs.32,28,173.50 (Thirty Two Lac Eighty One Thousand One Hundred Seventy Three Rupees and Fifty Paise) as of 08/11/2023	Date: 09/03/2024 Time: 02:30 PM Physical Possession Date: 09/03/2024 Time: 02:36 PM Physical Possession
Description of Secured Asset: Property-1: All that piece and parcel of immovable property being Residential Flat No.201, in Block No.O-2, on Second Floor, admeasuring 111 Sq.Yards Super Built-up area i.e. 92.80 Sq.meters, Carpet Area admeasuring 53 Sq.meters, togetherwith undivided land admeasuring 52.83 Sq.Yards i.e. 44.17 Sq.meters, in the scheme "Shree Takomath Residencj", constructed by Balaji Associates, a Partnership Firm, situated on Non Agricultural land bearing Old Block No.583, New Block/ Survey No.560 ad measuring 4790 Sq.meters Paiki Hissa No."D", New Survey No.308 admeasuring 20761 Sq.meters, situate, being and lying at Mouje Nandoli, Taluka Dahegan, in the Registration District Gandhinagar and Sub District Dahegan. Property-2: All that piece and parcel of immovable property being Residential Flat No.202, in Block No.O-2, on Second Floor, admeasuring 111 Sq.Yards Super Built-up area i.e. 92.80 Sq.meters, Carpet Area admeasuring 53 Sq.meters, togetherwith undivided land admeasuring 52.83 Sq.Yards i.e. 44.17 Sq.meters, in the scheme "Shree Takomath Residency", constructed by Balaji Associates, a Partnership Firm, situated on Non Agricultural land bearing Old Block No.583, New Block/ Survey No.560 ad measuring 4790 Sq.meters Paiki Hissa No."D", New Survey No.308 admeasuring 20761 Sq.meters, situate, being and lying at Mouje Nandoli, Taluka Dahegan, in the Registration District Gandhinagar and Sub District Dahegan.				
13	31029430000109	1) Manishkumar Bhavarlal Shah, 2) Shah Ashaben Manishbhai	08/09/2023, Rs.71,73,813.42 (Seventy One Lac Seventy Three Thousand Eight Hundred Thirteen Rupees and Forty Two Paise) as of 04/09/2023	Date: 10/03/2024 Time: 10:30 AM Physical Possession
Description of Secured Asset: All the piece and parcel of immovable Property being Flat No.701 on 7th Floor on having admeasuring 1810.80 Sq.ft.s, Situated on Known as "NIRMAN-1", of land bearing R.S. No.23 T.P. Scheme No.60, F.P. No.24, Plot No.32 Total admeasuring 204.60 Sq.mtrs. & Plot No.33 Total admeasuring 263.40 Sq.mtrs., C.S. No.2789/2/33 of Mouje Gotri at Sub-District Vadodara and District Vadodara.				
14	30538850000263	1) M/s. Krishna and Co., Represented by its Proprietor Jayaben Laxmanbhai Patel, 2) Mr. Jayaben Laxmanbhai Patel, Proprietor M/s. Krishna and Co., 3) Laxmanbhai Patel	17/02/2022, Rs.8,27,529.00 (Eight Lac Twenty Seven Thousand Five Hundred Twenty Nine Rupees Only) as of 17/02/2022	Date: 10/03/2024 Time: 11:20 AM Physical Possession
Description of Secured Asset: All that piece and parcel of the Immovable property bearing of Plot No.4 on Village Chhani, Shopping Centre, Shop No.3, Opposite Navapur, Amin Nagar Road, Near Khush Hospital, admeasuring 154.00 Sq.ft Super built up area being at Moje Chhani within Sub District & District Vadodara. Boundaries by: East: Road, West: Other Shop, North: Road, South: Nagrik Bank.				

Whereas, the Borrowers/ Co-borrowers/ Guarantors/ Mortgageors, mentioned herein above have failed to repay the amounts due, notice is hereby given to the Borrowers mentioned herein above in particular and to the Public in general that the authorized officer of **Jana Small Finance Bank Limited** has taken possession of the properties/ secured assets described herein above in exercise of powers conferred on him under section 13 (4) of the said Act read with Rule 8 of the said rules on the dates mentioned above. The Borrowers/ Co-borrowers/ Guarantors/ Mortgageors, mentioned herein above in particular and the Public in general are hereby cautioned not to deal with the aforesaid properties/ Secured Assets and any dealings with the said properties/ Secured Assets will be subject to the charge of **Jana Small Finance Bank Limited**.

Place: Ahmedabad
Date: 12.03.2024

Sd/- Authorised Officer
For. Jana Small Finance Bank Limited

JANA SMALL FINANCE BANK
(A scheduled commercial bank)

Registered Office: The Fairway, Ground & First Floor, Survey No.10/1, 11/2 & 12/2B, Off Domlur, Koramangla Inner Ring Road, Next to EGL Business Park, Challaghatta, Bangalore-560071. Regional Branch Office: 208 to 213, 2nd Floor, Shangrila Arcade, Above Saraswat Park, 100 Feet Anand Nagar Road, Shyamal, Ahmedabad, Gujarat-380015.

SURYODAY
A BANK OF SMILES

Suryoday Small Finance Bank Limited
Regd. & Corp. office : 1101, Sharda Terraces, Plot 65, Sector - 11, CBD Belapur, Navi Mumbai - 400614. CIN: L65923MH2008PLC261472.

APPENDIX-IV (RULE 8(1))
Possession Notice (For Immovable Property)

Whereas The undersigned being the Authorized Officer of the M/s. Suryoday Small Finance Bank Ltd., under the Securitization and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 (ACT NO.54 OF 2002) and in exercise of powers conferred under section 13(12) read with Rule 3 of the Security Interest (Enforcement) Rules, 2002 issued a demand notice to below mentioned Borrower/s / Guarantor/s. After completion of 60 days from date of receipt of the said notice, The Borrower/s / Guarantor/s having failed to repay the amount, notice is hereby given to the Borrower/s / Guarantor/s and the public in general that the undersigned has taken possession of the property described herein below in exercise of powers conferred on them under section 13(4) of the said Act read with Rule 6 & 8 of the Security Interest (Enforcement) Rules, 2002 on the date mentioned herewith:

Sr. NO	Name of Borrower / Co-Borrower/ Guarantor	Date of Demand Notice	Total O/s Amount (Rs.) Future Interest Applicable	Date of Symbolic Possession
	LAN No. 227000001838 1) SHAKTIKUMAR KANUBHAI BAROT, 2) BHAT SHILPAEN SHAKTIKUMAR	09/08/2023	11,21,815/- As on Date 27/07/2023	06-03-2024
1	Description of Secured Asset(s) /Immovable Property (ies) : ALL THAT PIECE AND PARCEL OF THE IMMOVABLE PROPERTY BEING A COMMERCIAL SHOP NO.3 ON GROUND FLOOR, ADMEASURING 7.92 SQ. MTRS. ON NON AGRICULTURAL LAND BEARING CITY SURVEY NO. 3445/A, PAIKI SITUATED, BEING AND LYING AT MOUJE, HIMMATNAGAR, TALUKA: HIMMATNAGAR, DIST: SABARKANTHA, GUJARAT-383001. Bounded By: EAST: SHOP NO. 4, WEST: SHOP NO.2, SOUTH: PASSAGE THEN SHOP OF SINDHI ARJUNBHAI, NORTH: VAIBHAV HOTEL.			
	LAN No. 217000000283 AND 227030000935 1) BIHOLA RUPSIH MANUJI, 2) BIHOLA CHIRAG	09/08/2023	16,86,539/- As on Date 27/07/2023	06-03-2024
2	Description of Secured Asset(s) /Immovable Property (ies) : ALL THAT PIECE AND PARCEL OF IMMOVABLE PROPERTY BEING (1) GRAM PANCHAYAT MILKAT NO.992 & (2) GRAM PANCHAYAT MILKAT NO.993 TOGETHER WITH CONSTRUCTION ERRECTED TO BE ERRECTED STANDING THEREON IN GOVANA VAS OF MOULE VASNA RATHOD TALUKA DEGHAM IN THE DISTRICT GANDHINAGAR & REGISTRATION SUB DISTRICT OF DEGHAM WITHIN THE STATE OF GUJARAT, THE SAID PROPERTY IS BOUNDED AS UNDER : BOUNDED BY: MILKAT NO.992 : NORTH- PUBLIC ROAD, EAST- ADJ. VIJAYBHAI ANUJI, SOUTH- HOUSE OF RUPSIH MANUJI 7 OPEN SPACE, WEST- OPEN SPACE. MILKAT NO.993 :NORTH- HOUSE OF RUPSIH MANUJI , EAST- HOUSE OF VIJAYJI MANUJI , SOUTH- PUBLIC ROAD , WEST- OPEN SPACE.			
	LAN No. 217030001937 AND 217050002524 1) PRATIKKUMAR P DAVE, 2) RAVAL SONALBEN MANUBHAI	09/08/2023	33,47,821/- As on Date 27/07/2023	06-03-2024
3	Description of Secured Asset(s) /Immovable Property (ies) : ALL THAT PIECE AND PARCEL OF IMMOVABLE RESIDENTIAL PROPERTY BEING A FLAT NO. 202 ON 2ND FLOOR OF BLOCK-C ADMEASURING AROUND 81.95 SQ. YARD I.E.68.52 SQ. MTRS CARPET AREA(SUPER BUILT UP AREA 137 SQ. YARD IN 114.54 SQ. MTRS)WITH UNDIVIDED RIGHT IN THE LAND ADMEASURING AROUND 37 SQ. MTRS OF THE SCHEME KNOWN AS "DEVMANEK-101" SITUATED ON THE LAND OF SURVEY NO. 345 HISSA NO.A AND SURVEY NO.345 HISSA NO.B, OF MOUJE/VILLAGE: NIKO/TALUKA:- VATVA, MORE SPECIFIC SITUATED ON THE LAND OF FINAL PLOT NO. 22 OF TPS NO. 121 OF MOUJE/VILLAGE: NIKOL, SUB DIST. ANDT. AHMEDABAD-12(NIKOL), Bounded By: NORTH- ROAD; SOUTH- FINAL PLOT NO. 25, EAST- ROAD; WEST- ROYAL BUNGLOW.			
	LAN No. 2170600001110 1)MRS. PRAJAPATI NILAMBEN RUPESHKUMAR, 2) MR.RUPESHBHAI DINESHBHAI PRAJAPATI, 3) MRS.PRAJAPATI SAROJBEN DINESHBHAI	13/12/2023	21,26,986.52/- As on Date 13/12/2023	06-03-2024
4	Description of Secured Asset(s) /Immovable Property (ies) : ALL THAT PIECE AND PARCEL OF PROPERTY BEARING FLAT NO.A. 702, ON THE 07TH FLOOR OF BLOCK NO.A ADMEASURING 60.94 SQ.METERS(CARPET AREA) IN THE SCHEME KNOWN AS "RADHE HILLS", CONSTRUCTED ON NON AGRICULTURE LAND BEARING BLOCK NO.458/A (OLD SURVEY NO.165,166,167,168 8173) SITE LIE LYING AND BEING AT MOUJE HATHIJAN IN THE REGISTRATION DISTRICT AHMEDABAD AND SUB DISTRICT AHMEDABAD 11(ASALI), GUJARAT.			
	LAN No. 217000002292 and 217060002757 1) DHAVALKUMAR THAKORBHAI PARMAR 2) GITABEN CHANDUBHAI GOHIL ALIAS GITABEN DHAVAL PARMAR	09/08/2023	21,61,931/- As on Date 27/07/2023	07-03-2024
5	Description of Secured Asset(s) /Immovable Property (ies) : ALL THAT THE PIECE AND PARCEL OF NON AGRICULTURAL PLOT OF LAND IN MOUJE SAVAJI PURA VADODARA LYING BEING LAND BEARING R.S. NO. 568, T.P. SCHEME NO. 1, O.P. NO. 80, F.P. NO. 18 ADMEASURING 29422 SQ.MTRS., PAIKI ADMEASURING 4649.70 SQ. MTS., KNOWN AS "SHREEJI ASHRAY" FLAT NO. D/303 ON THIRD FLOOR BUILT UP AREA ADMEASURING 49.71 SQ. MTRS., UNDIVIDED SHARE OF LAND AREA ADMEASURING 25.41 SQ. MTRS., AT REGISTRATION DISTRICT & SUB DISTRICT VADODARA, DISTRICT VADODARA 390019 GUJARAT. Bounded By:NORTH:- BY SKY OPEN SPACE & FLAT NO. D/304,SOUTH:BY SKY OPEN SPACE & FLAT NO. C/304, EAST : BY SKY OPEN SPACE, WEST: BY SKY OPEN SPACE & COMMON PASSAGE AND LIFT			
	LAN No. 227070000260 1) KIRANKUMAR CHHAGANBHAI KHUMAN 2) VIJAYKUMAR CHHAGANBHAI KHUMAN	09/08/2023	17,64,349/- As on Date 27/07/2023	07-03-2024
6	Description of Secured Asset(s) /Immovable Property (ies) : ALL THAT PIECE AND PARCEL OF NON AGRICULTURAL PLOT OF LAND IN MOUJE:KASBA, VISHAG-1, TIKA NO.18/3 VADODARA LYING BEING LAND CITY SURVEY NO.50/A ADMEASURING 343. 86.28 SQ.MTRS., KNOWN AS " SA ARKAN APARTMENT " PAIKI FLAT NO.104 ON FIRST FLOOR CONSTRUCTION ADMEASURING 650 SQ.FTS., INCLUDING UNDIVIDED SHARE OF LAND AT REGISTRATION DISTRICT & SUB DISTRICT VADODARA DISTRICT VADODARA , GUJARAT- 390006. Bounded By : EAST : BY FLAT NO.105, WEST:BY PUBLIC ROAD, SOUTH -BY FLAT NO.103, NORTH :BY PUBLIC ROAD.			

The Borrowers / Guarantors / in particular and the public in general is hereby cautioned not to deal with the property and any dealings with the property will be subject to the charge of the M/s Suryoday Small Finance Bank, for an above mentioned demanded amount and further interest thereon.

Place : GUJARAT, Date : 12-03-2024

Sd/- Authorised Officer, For Suryoday Small Finance Bank Limited

SBI STATE BANK OF INDIA
Stressed Assets Management Branch, Paramsidhi Complex, 2nd Floor, Opp. V. S. Hospital, Ellisbridge, Ahmedabad-380 006 Phone:079-26580794, Fax:079-26581137, E-mail: sbi.04199@sbi.co.in
Authorised Officer's Name : Shri. Kamal Kumar Garg, Mob : 9799053400

SALE NOTICE FOR SALE OF IMMOVABLE PROPERTIES
Appendix - IV-A [See Proviso to Rule 8 (6)]

E-Auction Sale Notice for Sale of Immovable Assets under the Securitisation and Reconstruction of Financial Assets and Enforcement of Security Interest Act, 2002 read with provision to Rule 8(6) of the security interest (enforcement) Rules, 2002

Notice is hereby given to the public in general and in particular to the Borrower(s) and Guarantor(s) that the below described immovable asset charged/ mortgaged to the Secured Creditor, the **Physical Possession** of which has been taken by the Authorised officer of **State Bank of India**, the Secured Creditor, will be sold on "**As is Where is**", "**As is What is**" and "**Whatever there is**" basis on **28.03.2024 for recovery of Rs. 14,27,99,290.93 as on 21.07.2019** and interest, expenses & costs thereon and thereafter of SBI, as per to pay vide demand Notice dated **22.07.2019** less: Recoveries thereafter if any due to the secured creditor from M/s. **Vikas Cotton Ginning and Pressing (Borrower) and Guarantors 1. Shri Afzalbhai Alarakhabhai Kaladia, 2. Shri Amin Alarakhabhai Kaladia, 3. Shri Mahmadrakif Alarakha Kaladia, 4. Smt. Yasmin Valimahmadbhai Hamirka (Ghanchi), 5. Smt. Rashida Alarakhabhai Kaladiya.**

The Bidders should get themselves registered on <https://www.mstccommerce.com/auctionhome/ibapi/index.jsp> by providing requisite KYC documents and registration fee as per the practice followed by M/s. **MSTC Ltd.** well before the auction date.

Date & Time of public E-Auction 28.03.2024 from 11:00 AM to 04:00 PM
with unlimited extension of 10 minutes each.

Property ID No.	Detail of Property	Reserve Price (Rs.)	Earnest Money Deposit (Rs.)	Bid increase Amount (Rs.)	Date & time of inspection
SBIN 100002814991	Factory Land and Building : All those pieces and parcels of the immovable property i.e. N.A. use land of R.S. No. 2570/p, behind Market Yard, at Halvad, Dist: Morbi, Gujarat - 363330, admeasuring 8094.00 Sq Mtrs. Built up area is 1636.00 Sq Mtrs with construction thereon, in the joint names of Smt. Rashida Alarakhabhai Kaladiya, Shri Afzalbhai Alarakhabhai Kaladia, Shri Amin Alarakhabhai Kaladiya and Shri Mahmadrakif Alarakha Kaladia. (Physical Possession) (Located very near to SH-7 Dhangadra - Morbi Highway, Halvad, Morbi Dist)	3,01,00,000/-	30,10,000/-	10,000/-	20.03.2024 12:00 Noon to 01:00 PM

Encumbrance: The intending bidders should make their own independent inquiries regarding the encumbrances, title of properties put on auction and claims / rights / dues / affecting the property prior to submitting their bid. The e-Auction advertisement does not constitute and will not be deemed to constitute any commitment or any representation of the bank. The property is being sold with all the existing and future encumbrances whether known or unknown to the bank. The Authorised officer / Secured Creditors shall not be responsible in any way for any third-party claims /rights /dues. TDS/GST/other taxes to be borne by purchaser over and above bid amount.

For detailed terms and conditions of the sale, please refer to the link provided in State Bank of India the Secured Creditor Website www.sbi.co.in, <https://bank.sbi>, <https://sbi.co.in/web/sbi-in-the-news/auction-notices/sarfaesi-and-others> and <https://www.mstccommerce.com/auctionhome/ibapi/index.jsp>, <https://ibapi.in> or contact to **Kamal Kumar Garg AGM&CLO, Mob. No. 9799053400 & Mob. No. 9440780127**

This Notice Should also be considered as 15 Days notice to the Borrowers / Guarantors / Mortgageors under Rule 8 (6) of the Security Interest (Enforcement) Rule-2002

Direct Link to E-auction website	Auction details Bank web site	Property Location :
		2654+Q3, Halvad

Date : 12.03.2024
Place : Ahmedabad

Sd/- Authorized Officer, State Bank of India

STATE BANK OF INDIA
SARB Vadodra 2nd Floor, Samyak Status, Opp. D R Amin School, Divalipura Main Road, Vadodra - 390007 Phone: 0265-2225282, E-mail : sbi.10059@sbi.co.in

CORRIGENDUM

Sale notice published in news paper dated 11.03.2024 please read as sale notice for sale of IMMOVABLE PROPERTIES instead of sale notice for sale of MOVABLE PROPERTIES. Appendix-IV-A[See Proviso

નિમણુંક ૧૫ માર્ચ સુધીમાં જગ્યા ભરવા માટે ૭ માર્ચે કરવામાં આવે તેવી શક્યતા રોજાનાની સમિતિની મુલતવી કરવામાં આવેલી બેઠકનો સુચરોએ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.લોકસભાની ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત પોલ પેનલ કરે તેવી શક્યતા છે.તેના થોડા દિવસો પહેલા જ ગોયલે શુક્રવારે સરખા રાજાનામું આપી દીધું હતું. શનિવારે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મૂએ તેમનું રાજાનામું સ્વીકાર્યું હતું. અને કેન્દ્રીય કાયદા મંત્રાલયે એક જાહેરાત કરવા માટે થોડા જાહેરનામું બહાર પાડ્યું હતું.



MISHTANN
FOODS LIMITED

મિષ્ટાન્ન ફૂડ્સ લિમિટેડ

CIN: L15400GJ1981PLC004170

રજી. એનિસ્ટ્રી: B-9005, એમપાર્ય વિભાગેના હબ, શાસ્ત્રી હાઈવેની સામે, સાયબર સીટી રોડ, ચોલા, દક્ષીણ, મહેસાણા, ગુજરાત-380 060 રાજ. નંબર: 01 9824623116, ફેક્સ નંબર: 01 7940033116
 વેબસાઈટ: www.mishtann.com ઈમેલ આઈડી: cs@mishtann.com

સૂચના

ત્રિકલપોટીસીટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (ફિલિંગિંગ એપ્રોવિંગેશન્સ એન્ડ ડિસ્કલોઝર રિજલેશનરેન્જ) રેગ્યુલેશન્સ, 2015 ના નિયમન 42 ને અનુસરીને, આથી સૂચના આપવામાં આવે છે કે કંપનીએ બુધવાર, 20 માર્ચ, 2024 ના રોજની કક્ષણી નક્કી કરવા માટે 'રેકોર્ડ તારીખ' તરીકે નિયત કરી છે. ચાહેંચા રૂઢિચઢાઈ ઈલેક્ટ્રીક ઇન્ધમમાં સમયે 3,32,66,667 ઈલેક્ટ્રીક ડેરેન્ડાની ફેસ વેલ્યુના, 3/ 1-ની કિંમતે ઢેરકે 3/ 15/- પ્રતિ રેર, પ્રીમિયમ સહિત 3/ 14/- પ્રતિ રેર, ના 1 ઈલેક્ટ્રીક ઢેરના રૂણોત્તરમાં 3/ 1/- ઢેરક માટે ના ઢેરક 31 ઈલેક્ટ્રીક રેર 3/ 1/- ઢેરકે રેકોર્ડ તારીખે રાખવામાં આવે છે.

મિષ્ટાન્ન ફૂડ્સ લિમિટેડ માટે

સહી/-

શિવાંગી શાહ

કંપનીના સચિવ

તારીખ: ૧૧/૦૩/૨૦૨૪

સ્થળ: અમદાવાદ

[illegible]


Sr. No.	TMID	SEBI Registration Number	Name of the Member	Date of surrender application	Member's Correspondence Address	Claim Period from the date of notification
1	76	INZ000054733	Gee Kay Tradecom Limited	11-Jan-23	Shop no. 2, First Floor, 20/A, Maruti Tower, Sanjey Place, Agra - 282002	2 Months
2	1242	INZ000095638	BgSE Financials Limited	20-Jan-23	No 51, Stock Exchange Towers, 1st cross, JC Road, Bangalore - 560027	15 Days
3	1299	INZ000203739	Ashlar Securities Private Limited	2-Feb-23	A-38, Sector-67, Noida - 201301.	1 Months
4	1058	INZ000020232	Superior Agro Crops Private Limited	5-Jun-23	C-35/5, Laxmjee Road Ind Area, Delhi - 110035	2 Months
5	15	INZ000083319	Aihant & Co - Sole Prop, Pramod Kumar Lodha	14-Jul-23	578, Mahavir Nagar, Tonk Road, Jaipur - 302018	2 Months
6	720	INZ000082436	First Global Commodities Private Limited	8-Aug-23	Rathnam Square, Plot No. 38/39, 2nd Floor, Sector 19 A, Vashi, Navi Mumbai - 400703.	1 Months


General public is requested to take note of the surrender of the above member(s) and not to trade/clear with the said member(s) in future.

The registered constituent (s) of the aforesaid member(s) who have undertaken any trades/clearing through these member(s) are hereby advised to lodge the claims, if any against the said member(s) within the above mentioned claim period from the date of this notification, failing which, it shall be presumed that there is no claim against the aforesaid member(s) and that all claims against the member(s) shall be deemed to be waived off. Adjudication of the claim shall be at the sole discretion of the Exchange and/or upon the regulatory directives, if any.

The constituent(s) may write with all the relevant papers to Ms. Smrita Chaudhary, Senior Vice President, Investor Services Centre (ISC) department, National Commodity & Derivatives Exchange Ltd, Ackurti Corporate Park, LBS Marg, KanjurMarg (W), Mumbai 400 078 or email at ig@ncdex.com

Mumbai
Date: 12.03.2024


NCDEX
NATIONAL COMMODITY DERIVATIVES EXCHANGE

 **PG Foils Ltd.**

Regd. Office: No. 3, Neptune Tower, Ashram Road, Ahmedabad-380 009 (Gujarat)
Website: pgfoils.in, **CIN:** L27203GJ1979PLC008050

POSTAL BALLOT NOTICE AND E-VOTING INFORMATION

Notice is hereby given that the company is seeking approval of its members by way of special resolution for re-appointment of Mr. Pankaj Raj Shah (DIN 00160558) as a Managing Director for a term of five years, as approved by board of directors of the company at its meeting held on Tuesday, January 09, 2024.

The notice of postal ballot is available on the website of the company www.pgfoils.in, Central Depository Services (India) Limited www.evotingindia.com and websites of the Stock Exchanges, i.e. BSE Limited at www.bseindia.com

In compliance with Ministry of Corporate Affairs General Circular Nos. 14/2020 dated April 8, 2020, 17/2020 dated April 13, 2020, 22/2020 dated June 15, 2020, 33/2020 dated September 28, 2020, 39/2020 dated December 31, 2020, 10/2021 dated June 23, 2021, 20/2021 dated December 8, 2021, 02/2022 dated May 5, 2022 and 11/2022 dated December 28, 2022 and 09/2023 dated September, 2023 this postal ballot notice is being sent only through electronic mode to those members whose e-mail addresses are registered with the Company/Depositories and whose names are recorded in the Register of Members of the Company or in the Register of Beneficial Owners maintained by the Depositories as on the Cut-off date i.e. Friday, March 08, 2024 ("Cut-off date").

The Company has engaged the services of Central Depository Services (India) Limited ("CDSL") to provide remote e-voting facility to its Members. The remote e-voting period commences from 9:00 a.m. (IST), Thursday, March 14, 2024 and ends at 5:00 p.m. (IST), Saturday, April 13, 2024. The e-voting module shall be enabled by CDSL thereafter. Communication of assent or dissent of the Members would only take place through the remote e-voting system.

The results of voting by Postal Ballot will be announced within two working days from the last date of e-voting i.e. April 13, 2024. The said result would be intimated to BSE and will be uploaded on the company's website www.pgfoils.in and on the website of CDSL www.evotingindia.com.

In case of any queries or issues regarding e-Voting from the CDSL e-Voting System, you can write an email to helpdesk.evoting@cdslindia.com or contact at 022-23058738 and 022-23058542/43.

Date: 11.03.2024
Place: Pipalia Kalan

For PG Foils Limited
Sahil P Shah
(Whole Time Director)

ફાઈનાન્સ લિમિટેડ		
અમરોડ, અમદાવાદ-૩૮૦૦૦૯. ફોન : ૭૭૯-૪૧૧૦૬૫૦૦/૭૭૩૩		
નોટીસ		
એસેટ્સની પુનઃલિખન અને સુરક્ષાની સલામતી (ઓ) રૂપા ૨૦૦૨ - નિયમોના નિયમ ૩ સાથે વાંચવા		
રૂપા અધિકૃત અધિકારી એક્ટની કલમ ૧૨ (૨) ની સાથે અધિનિયમોના અધિનિયમ ૩ ને અનુસરીને (રો) સહ અજદાર(રો) જામીન(નો) તમામને વ્યક્તિગત રીતે અથવા એક સાથે ય અ અને નીચે જણાવેલ યાદીમાં આપવામાં આવેલ છે, ને આથી નીચે પાઠવામાં આવેલ વિગતો અનુસાર ભરપૂર્ કરી જવા માંગણી નોટિસ જે તે તારીખ ની બે દશાંવેલ મુજબ વાસ્તે એકીથી પાઠવામાં આવેલ છે અને ને નીચે સહી કરનારા પાસે પણ મળી શકશે, અને ને તેનો સદર નફલ ની સહી કરનાર વચ્ચેથી સામાન્ય કચેરીના કામના કલાક દરમિયાન (ઓ) કે બંધનકર્તા(ઓ) કાયદેસરના વારસદાર(રો) કાયદેસરના પ્રતિનિધિ(ઓ)એ સદર અને એકસાથે નીચે ક્રોલમાં દર્શાવેલી વિગતો અનુસાર સંબંધિત તારીખે વધારાના વ્યાજ સાથે વંચાણે લેતાં, જો કે, સદર બંધનકર્તા(ઓ) દ્વારા અમલ બજાવણી કરવામાં આવેલ નું બાકી લેણા સામે MRHMFNL ને સદર બંધનકર્તા(ઓ)એ તારણ સંબંધે નીચે દર્શાવેલ		
નું વર્ણન	લોન એકાઉન્ટ નંબર લેલી રકમ	ફિનાન્સ નોટીસ તારીખ સ્ટીકીંગ નોટીસ તારીખ
કતના પારસલ માં ધરાવતા દ્વેલેટ નંબર ૧૦૪, ૧૦૫ પૈકી ઓ.એ. જમીન પૈકી અને રજાદે માંપણી શહેર ૪૮.૯૫ અને રજાદે હાલ ચો. મી. ગિરડેલ ચો. મી.	લોન એકાઉન્ટ નં. : ૬૭૬૨	તા. ૨૭-૦૯-૨૦૨૩
નિભિભાજિત હક સાથે ની જાહેર માંપણી તરીકે ઓળખાતી યોજનામાં સ્થિત સર્વે ૧૦૪, ૧૦૫ પૈકી ઓ.એ. જમીન પૈકી લોટ નં. ૮૫, ૮૬, ૮૭, ૧૩૨, ૧૩૩, ૧૩૭, ૧૩૮, ૧૩૯, ૧૪૦, ૧૪૧, ૧૪૨, ૧૪૩, ૧૪૪, ૧૪૫, ૧૪૬, ૧૪૭, ૧૪૮, ૧૪૯, ૧૫૦, ૧૫૧, ૧૫૨, ૧૫૩, ૧૫૪, ૧૫૫, સુરત ના રજીસ્ટ્રેશન જિલ્લા અને	રૂ. ૬,૧૦,૮૮૭.૦૦	તા. ૦૫-૦૩-૨૦૨૪
કતના પારસલમાં ધરાવતા દ્વેલેટ નંબર ૪, ૮ ચો. મી. ખુલ્લી જગ્યા ના પ્રમાણસર ની જાહેર માંપણી ઉ.૩૩ ચો. મી., રોક માં “શ્રી રામ રેસિડેન્સી” તરીકે બ્લોક નં. ૪૩૭, ૪૩૫, ૪૩૬, ૪૩૭, ૪૩૮, ૪૪૮, ૪૪૯ (એકી કરણ પછી નો ઓ.એ. જમીન પૈકી “શ્રી રેસિડેન્સી” બ્લોક નંબર ૨૮, ગામ હલધર ખાતે રજીસ્ટ્રેશન જિલ્લા અને પેટા જિલ્લામાં,	લોન એકાઉન્ટ નં. : ૬૭૬૬	તા. ૨૦-૦૯-૨૦૨૩
કતના પારસલમાં ધરાવતા દ્વેલેટ નંબર ૪, ૮ ચો. મી. ખુલ્લી જગ્યા ના પ્રમાણસર ની જાહેર માંપણી ઉ.૩૩ ચો. મી., રોક માં “શ્રી રામ રેસિડેન્સી” તરીકે બ્લોક નં. ૪૩૭, ૪૩૫, ૪૩૬, ૪૩૭, ૪૩૮, ૪૪૮, ૪૪૯ (એકી કરણ પછી નો ઓ.એ. જમીન પૈકી “શ્રી રેસિડેન્સી” બ્લોક નંબર ૨૮, ગામ હલધર ખાતે રજીસ્ટ્રેશન જિલ્લા અને પેટા જિલ્લામાં,	રૂ. ૬,૮૬,૫૦૬.૦૦	તા. ૦૬-૦૩-૨૦૨૪
કતના પારસલમાં ધરાવતા દ્વેલેટ નંબર ૪, ૮ ચો. મી. ખુલ્લી જગ્યા ના પ્રમાણસર ની જાહેર માંપણી ઉ.૩૩ ચો. મી., રોક માં “શ્રી રામ રેસિડેન્સી” તરીકે બ્લોક નં. ૪૩૭, ૪૩૫, ૪૩૬, ૪૩૭, ૪૩૮, ૪૪૮, ૪૪૯ (એકી કરણ પછી નો ઓ.એ. જમીન પૈકી “શ્રી રેસિડેન્સી” બ્લોક નંબર ૨૮, ગામ હલધર ખાતે રજીસ્ટ્રેશન જિલ્લા અને પેટા જિલ્લામાં,	લોન એકાઉન્ટ નં. : ૬૮૦૪	તા. ૨૦-૦૯-૨૦૨૩
કતના પારસલમાં ધરાવતા દ્વેલેટ નંબર ૪, ૮ ચો. મી. ખુલ્લી જગ્યા ના પ્રમાણસર ની જાહેર માંપણી ઉ.૩૩ ચો. મી., રોક માં “શ્રી રામ રેસિડેન્સી” તરીકે બ્લોક નં. ૪૩૭, ૪૩૫, ૪૩૬, ૪૩૭, ૪૩૮, ૪૪૮, ૪૪૯ (એકી કરણ પછી નો ઓ.એ. જમીન પૈકી “શ્રી રેસિડેન્સી” બ્લોક નંબર ૨૮, ગામ હલધર ખાતે રજીસ્ટ્રેશન જિલ્લા અને પેટા જિલ્લામાં,	રૂ. ૬,૦૫,૨૮૫.૦૦	તા. ૦૬-૦૩-૨૦૨૪

[illegible]